

# ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

## અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે તા. ૦૬/૧૦/૨૦૧૮ ના રોજ જાહેરાત ક્રમાંક: ૧૪૬/૨૦૧૮૧૯ થી ૧૪૯/૨૦૧૮૧૯ પ્રસિધ્ધ કરી ઓન-લાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ છે. જે પૈકીની નીચે દર્શાવેલ સંવર્ગોની પ્રથમ તબક્કાની MCQ-OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાનાર છે. જે અન્વયે સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેની તારીખ નક્કી કરીને તા. ૨૫/૧૦/૨૦૧૯ ના રોજ મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. જે સંદર્ભે ઉક્ત દરેક સંવર્ગની પરીક્ષા માટેના કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ નીચે દર્શાવ્યા પ્રમાણેનો મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.

અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

### સ્પર્ધાત્મક લેખિત કસોટી

અ. નં.	જાહેરાત ક્રમાંક/ સંવર્ગનું નામ	પરીક્ષાની તારીખ/ સમય	કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ-સમયની વિગતો
૧	૧૪૬/૨૦૧૮૧૯ લેબોરેટરી ટેકનીશીયન	૩૦/૧૧/૨૦૧૯ ૧૫-૦૦ થી ૧૭-૦૦	તા. ૨૦/૧૧/૨૦૧૯, બપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૩૦/૧૧/૨૦૧૯, બપોરે ૧૫-૦૦ કલાક સુધી
૨	૧૪૯/૨૦૧૮૧૯ ટેકનીકલ આસીસ્ટન્ટ	૦૧/૧૨/૨૦૧૯ ૧૨-૦૦ થી ૧૪-૦૦	તા. ૨૦/૧૧/૨૦૧૯, બપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૦૧/૧૨/૨૦૧૯, બપોરે ૧૨-૦૦ કલાક સુધી
૩	૧૪૮/૨૦૧૮૧૯ માઇન્સ સુપરવાઇઝર	૦૨/૧૨/૨૦૧૯ ૧૫-૦૦ થી ૧૭-૦૦	તા. ૨૦/૧૧/૨૦૧૯, બપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૦૨/૧૨/૨૦૧૯, બપોરે ૧૫-૦૦ કલાક સુધી

ઉમેદવારોએ જે તે સંવર્ગની પ્રથમ તબક્કાની MCQ-OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના કોલ-લેટર તથા તે સાથેની જરૂરી સુચનાઓ સહિત ઉપર દર્શાવેલ નિયત તારીખ-સમયગાળા દરમિયાન "[https:// ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in)" વેબસાઇટ પરથી અચૂક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

પ્રવેશપત્ર "ON LINE" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) "[https:// ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in)" વેબસાઇટ પર જવું. (૨) MCQ-OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના ઉમેદવારોએ " Call Letter" પર "Click" કરવું. (૩) ત્યાર બાદ "Primary Call Letter" પર "Click" કરીને Select job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં "Confirmation Number" તથા "Birth Date" ટાઇપ કરીને OK પર Click કરવાથી અલગ Window માં આપનો Call letter (પ્રવેશપત્ર ) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter

તથા તે સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ( કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે **Pop up Blocker Off** કરવું જરૂરી છે. )

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સુચનાઓની વિગતો કે જે સ્પર્ધાત્મક લેખિત કસોટી સમયે હાજરીપત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોઈ તે અચૂક વાંચી જવી. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના નાયબ સચિવશ્રી (તાંત્રિક પરીક્ષા) નો કચેરી સમય દરમિયાન ફોન નંબર:- ૦૭૯- ૨૩૨૫૩૬૨૮ પર સંપર્ક કરી શકાશે.

સ્થળ:- ગાંધીનગર  
તારીખ- ૨૦/૧૧/૨૦૧૯

સચિવ  
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  
ગાંધીનગર